

14

કેટલું મોટું? કેટલું ભારે?



સારિકા લખોટીઓ, સિક્કા, રબર વગેરે જેવી વस્તુઓ એકઠી કરે છે. તે એક ગ્લાસમાં થોડું પાણી લે છે અને પાણીની ઉપલી સપાટી આગળ '0' એવું નિશાન કરે છે.



જો હું આ ગ્લાસમાં 5 લખોટીઓ નાખું તો શું તમે અંદાજ લગાડી શકો કે પાણીની સપાટી ક્યાં પહોંચશે?



હું વિચારું છું કે
તે અહીં સુધી
પહોંચશે

તેણે ગ્લાસમાં 5 લખોટીઓ નાખી. આથી પાણીની નવી સપાટી
પર તેણે નિશાન કર્યું.

અરે! તે કેવી રીતે
અનુમાન કર્યું! શું તને
લખોટીઓના (ઘનફળ)
કંની જાણકારી હતી?



મેં માત્ર અનુમાન જ લગાવ્યું
કે લખોટીઓ પાણીને કેટલે
ઉંચે સુધી લઈ જશે. તું
લખોટીનું કંદ (ઘનફળ) કેવી
રીતે શોધીશ?



જુઓ દરેક લખોટી પાણીને થોડુંક ઉંચે
ચડાવશો. બરાબર? કારણ કે તેઓ થોડીક જગ્યા
રોકશે તે તેનું કંદ (ઘનફળ) થયું ગણાય.

વિદ્યાર્થીઓને ઘન પદાર્થનું કંદ અંદાજથી અને અનૌપચારિક રીતે મેળવીને તુલના કરવા માટે વધુ સ્વાધ્યાયની જરૂર છે. ઔપचારિક માપ જેવાં કે લિટર અને ઘન સેન્ટિમીટર વગેરેની રીતો શીખે તે પહેલાં તેમને લખોટીઓ, સિક્કા, દીવાસળીનાં ખોખા વગેરેના ઉપયોગથી કંદ વિશેની સમજ પેદા કરો. તે માટે પ્રોત્સાહિત કરો.



* માપક ગ્લાસ

હવે તમે અનુમાન કરો. શું પાંચ રૂપિયાના દસ સિક્કાનું કદ એ 10 લખોટીઓ કરતાં વધુ હોઈ શકે?



નીચેનામાંથી પ્રત્યેકનાં કદ વિશે અનુમાન લગાવો :

- * એક દો લગભગ _____ લખોટીઓ જેટલું કદ ધરાવે.
- * એક રબર લગભગ _____ લખોટીઓ જેટલું કદ ધરાવે.
- * એક લીબુ લગભગ _____ લખોટીઓ જેટલું કદ ધરાવે.
- * એક પેન્સિલ લગભગ _____ લખોટીઓ જેટલું કદ ધરાવે.
- * એક બટાડું લગભગ _____ લખોટીઓ જેટલું કદ ધરાવે.



હવે 35 લખોટીઓની મદદથી તમારી રીતે એક માપક ગ્લાસ બનાવો.

પાણીનો એક ગ્લાસ લો તથા પાણીની સપાટી આગળ '0' નિશાન કરો. ત્યાર બાદ તેમાં 5 લખોટીઓ નાંખો અને પાણીની સપાટી આગળ 5 M એવું નિશાન કરો.

ફરીથી 5 લખોટીઓ નાખો અને પાણીની સપાટી આગળ 10 M નિશાન લગાવો આ જ રીતે, 15 M, 20 M, 25 M, 30 M અને 35 M નાં નિશાન લગાવો.

હવે દરેક વસ્તુને તમારા બનાવેલા માપક ગ્લાસમાં નાખો અને તમારું અનુમાન ચકાસો.

બિન્ન વસ્તુઓ જેવી કે દીવાસળીનાં ખોખા, પથ્થર વગેરે વસ્તુઓ તે ગ્લાસમાં નાંખો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો :



વસ્તુનું નામ	તેનું કદ (કેટલી લખોટી -ઓ બરાબર)

વિદ્યાર્થીઓ ગ્લાસ ઉપર કાગળની પણી ચોંટાડે તથા પાણીની સપાટી આગળ નિશાન કરવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ કરો. કદની વ્યાપ્તા આખા સિવાય ઉદાહરણો અને પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં કદની સમજનો વિકાસ થાય તેવો હેતુ છે. વસ્તુઓની સરખામણી લંબાઈ કે ક્ષેત્રફળમાં કરવા કરતાં કદ પર કરવી વધુ યોગ્ય છે.





શાનું કદ વધુ છે?

શું તમે મને 6 લખોટીઓનું કદ મિલીમાં બતાવી શકો?



હા, જો આપણો એક માપક શીશી બનાવીએ તો.

ધોરણ-4માં તમે 250 મિલીની એક માપક શીશી બનાવી હતી.

શું તમે આવી માપક શીશી બનાવવાની રીત વિચારી શકો છો કે જેનાથી 10 મિલી, 20 મિલી, 30 મિલી, 60 મિલી વગેરે માપી શકાય? તમારા મિત્ર સાથે ચર્ચા કરો.

તારીક અને મૌલીએ તેમની માપક શીશી બનાવી.

તારીક પાસે એક ઈંજેક્શન સિરિજ હતી. તેણે માપક શીશી બનાવવા માટે આ સિરિજનો ઉપયોગ કર્યો. મૌલીએ એક ખાલી શીશીનો ઉપયોગ કર્યો.



મેં ઈંજેક્શન સિરિજમાં એક વખતે 5 મિલી પાણી ભર્યું મારી શીશી પર 10 મિલીનું નિશાન કરવા માટે મેં બે વખત પાણી શીશીમાં નાંખ્યું.



મેં મારી માપક શીશી બનાવવા માટે 10 મિલી માપની એક દવાની ખાલી શીશીનો ઉપયોગ કર્યો.

મૌલીએ પાંચ રૂપિયાના સિક્કાનું કદ શોધવા માટે તેની માપક શીશીનો ઉપયોગ કર્યો. તેણે જોયું કે પાંચ રૂપિયાના નવ સિક્કા 10 મિલી પાણીને ઉપરની તરફ ખસેડે છે. આથી તમે પણ તમારી માપક શીશી બનાવવા માટે પાંચ રૂપિયાના 9 સિક્કાનો ઉપયોગ કરી શકો! કરી જુઓ!

તમારી માપક શીશીનો ઉપયોગ કરી શોધી કાઢો.

(a) 6 લખોટીઓનું કદ (ઘનફળ) કેટલું થાય? _____ મિલી




- (b) એક રૂપિયાના 16 સિક્કાનું કદ કેટલું થાય? _____ મિલી હવે નીચેનાને મનમાં ઉકેલો.
- (c) 24 લખોટીઓનું કદ (ઘનફળ) _____ મિલી થાય.
- (d) એક રૂપિયાના 32 સિક્કાનું કદ કેટલું થાય? _____ મિલી
- (e) મૌલીએ પાંચ રૂપિયાના કેટલાક સિક્કા માપક શીશીમાં નાંખ્યા. તેણે તેમાં કેટલા સિક્કા નાંખ્યા હશે ,
 * જો 30 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો? _____
 * જો 60 મિલી જેટલું પાણી ઉપરની તરફ ધકેલાયું હોય તો? _____
- પહેલાં અનુમાન કરો અને પછી કેટલીક અન્ય વસ્તુઓનાં કદ (મિલીમાં) શોધવા માટે તમારી માપક શીશીનો ઉપયોગ કરો.

વસ્તુ	તેનું કદ (મિલીમાં)

અનુમાન કરો કે પાણીની અંદર ગયા પછી તમારું શરીર કેટલા લિટર પાણીને ઉપર તરફ ધકેલશે?



તેમાં કેટલું સમાઈ શકે?



આ એક સમધન છે જેની પ્રત્યેક બાજુનું માપ 1 સેમી છે જુઓ કે તમારા ગાણિત-ગમ્ભીર પુસ્તકની ઊંચાઈ 1 સેમી છે. તેથી અનુમાન કરો કે 1 સેન્ટિમીટરના કેટલા સમધન તમારા ગાણિતના પુસ્તક જેટલી જગ્યા રોકે?

માપક શીશી બનાવવા માટે વિદ્યાર્થીઓને પહોળા મૌખિક અને પારદર્શક શીશીનો ઉપયોગ કરવા કહો કે જેથી તેના પર નિશાનીઓ સરળતાથી કરી શકાય. આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં માપન કૌશલ્ય વિકસાવવાનો અને ગાણિતના વર્ગખંડમાં વિવિધ સાધનો બનાવવાનું તેમજ તેને સંભાળવાનું (જેમકે માપક શીશી) શીખવવાનો છે.



અરે! મારું ગણિત-ગમતનું
પુસ્તક આશરે _____ સેમી લાંબુ છે
આથી _____ સમધન તેની લંબાઈ
પર ગોઠવાઈ શકશે.




આથી કુલ 1 સેમીના _____
સમધન ગણિત-ગમતના
પુસ્તક પર ગોઠવાઈ શકે.



અને આ લગભગ _____ સેમી
પહોળું છે. આથી 1 સેમીના _____
સમધન તેની પહોળાઈ પર
ગોઠવી શકશે.



હવે, જો આ બધા સમધનને એક હરોળમાં ગોઠવવામાં આવે તો તે હરોળ કેટલી લાંબી થશે? _____ સેમી



મહાવરો

- (1) ગણિત-ગમતનાં પાંચ પુસ્તક દ્વારા એક મંચ બનાવવામાં આવ્યો. આ મંચનું કદ એ 1 સેમીના..... સમધન જેટલું થાય.
- (2) આ વસ્તુઓનાં કદનો 1 સેમીના સમધનમાં અંદાજ લગાવો :
 - * એક દીવાસળીનું ખોખું આશરે 1 સેમીના..... સમધન જેટલું થાય.
 - * એક જ્યોમેટ્રી બોક્સ આશરે 1 સેમીના..... સમધન જેટલું થાય.
 - * એક રબર આશરે 1 સેમીના..... સમધન જેટલું થાય.




તમે તમારું અનુમાન કેવી રીતે તપાસશો? આ અંગે ચર્ચા કરો.

દિવાસળીનાં ખોખાની રમત


તનુ દીવાસળીનાં ખોખાની મદદથી એક મંચ બનાવી રહી છે.

તેણે આ રીતે દિવાસળીનાં 14 ખોખા ગોઠવીને પ્રથમ સ્તર બનાવ્યું છે.



‘કેટલાં સમાઈ શકે’ જેવી પ્રવૃત્તિ માટે વિદ્યાર્થીઓને 1 સેમી માપના સમધનની સમજ હોવી જરૂરી છે. વિવિધ આકારોનાં કદ (ઘનફળ)
શોધવા માટે શિક્ષક કેટલાંક સેમીના માપના સમધન બનાવે તથા દીવાસળીનાં ખોખાનાં વિવિધ મોડેલ બનાવવા ઉપયોગ કરી શકે. તનું
સ્ટેજ (મંચ) તથા મોહનનું મોડેલ એ એવાં ઉદાહરણો છે કે જેમાં વિદ્યાર્થીઓ કદને દીવાસળીનાં ખોખામાં માપે છે અને પછી 1 સેમીના
સમધનમાં રૂપાંતરિત કરે છે.





તે આવા 4 સ્તર બનાવે છે અને તેનું સ્ટેજ (મંચ) કંઈક આ પ્રકારે દેખાય છે.

* તેણે આ સ્ટેજ (મંચ) બનાવવા માટે દીવાસળીનાં _____ ખોખાનો ઉપયોગ કર્યો




- * દીવાસળીનાં એક ખોખાનું કદ એ 10 સેમીના સમધન જેટલું છે તો આ મંચનું કદ એ _____ સેમીના સમધન જેટલું થાય.
- * જો આ બધા સમધનને એક હરોળમાં ગોડવવામાં આવે, તો તે હરોળ કેટલી લાંબી થશે? _____ સેમી.
- * કોણું કદ (ઘનફળ) વધારે છે? - તમારા ગણિત-ગમ્ત પુસ્તકનું કે તનુના સ્ટેજ (મંચ)નું?

તમારા મિત્ર સાથે મળીને સમાન માપનાં ઘણાંબધાં દીવાસળીનાં ખાલી ખોખા એકઠાં કરો, તેની બાજુઓ માપો અને અહીં લખો.

મારું દીવાસળીનું ખોખાં _____ સેમી પહોળું છે.

તે _____ સેમી લાંબું છે.



તે _____ સેમી ઊંચું છે.

- * દીવાસળીનાં 56 ખોખાનો ઉપયોગ કરીને વિવિધ ઊંચાઈના મંચ બનાવો. આ કોષ્ટક પૂર્ણ કરો.

	તેની ઊંચાઈ કેટલી?	તેની લંબાઈ કેટલી?	તેની પહોળાઈ કેટલી?
મંચ 1			
મંચ 2			
મંચ 3			

દરેક મંચનું કદ (ઘનફળ) દીવાસળીનાં _____ ખોખા જેટલું થશે.

- * તમે બનાવેલા સ્ટેજ (મંચ)નાં વાસ્તવિક ચિત્ર બનાવો.



મહાવરો

મોહન દિવાસળીનાં ખોખાને કંઈક આવી રીતે ગોઠવ્યા.


- તેણે આ બનાવવા માટે દિવાસળીનાં કેટલાં ખોખાનો ઉપયોગ કર્યો? તેનું દિવાસળીનાં ખોખામાં કદ કેટલું?
_____ ખોખા.
- દિવાસળીનાં ખાલી ખોખા એકઠાં કરો. તેને કંઈક અલગ રીતે ગોઠવો. તેનું વાસ્તવિક ચિત્ર બનાવો.



કાગળનો સમધન બનાવો.

આનન અને તેનાં મિત્રો કાગળમાંથી સમધન બનાવે છે. તેઓએ બાજુનું માપ 19.5 સેમી હોય તેવો ચોરસ કાગળની શીટમાંથી કાઢ્યો. તેઓએ આવા 6 ચોરસ કાઢ્યા. નીચેની તસવીરોને અનુસરો અને તમારો સમધન બનાવો.


1. આ પ્રકારની રેખાઓ બનાવવા માટે કાગળને ચાર સરખા ભાગમાં વાળો.




2. ઉપર ડાબી બાજુના ખૂણાને અને તેની સામેના ખૂણાને આ રીતે વાળો.




3. ઉપર તથા નીચેની ધારોને એ રીતે વાળો કે જેથી તે મધ્યરેખાને મળો. હવે ખૂણા Pને વાળો...




4. આથી કાગળ કંઈક આ રીતે દેખાશો.



5. આ જ રીતે ખૂણા Qને વાળો. હવે કાગળ કંઈક આ રીતે દેખાશો.



6. ખૂણા Pને ઉઠાવીને તેને વાળેલા કાગળની નીચે આ રીતે સરકાવો.




વિદ્યાર્થીઓને સમાન એકમોનો ઉપયોગ કરી સમાન કદના વિવિધ આકારો બનાવવા માટે પ્રોત્સાહિત કરો. ઉદાહરણ તરીકે ઈંદ્રો અથવા દિવાસળીનાં ખોખા. મંચની બાજુઓ માપવા માટે, લંબાઈને નજીકના પૂર્ણાકમાં ફેરવીને સેમીમાં ગણતરી કરો.







7. ખૂણા Q માટે પણ આ પ્રમાણે જ કરો. કાગળ કંઈક આ રીતે દેખાશે.



8. કાગળને ફેરવો અને તેને એ રીતે વાળો કે જેથી રેખાઓ કંઈક આવી હેખાય.



9. દરેક વિદ્યાર્થી આ રીતે એક ટુકડો બનાવશે. 6 વિદ્યાર્થીઓ આવા 6 ટુકડાઓને એકની અંદર એક નાંખીને આ રીતે કાગળનો સમધન બનાવશે.




નોંધ : યાદ રાખો કે, શરૂઆતમાં 19.5 સેમીના માપની બાજુવાળો ચોરસ લીધેલ છે. વળી, બીજા પગથિયામાં તમે બધા ડાબા ખૂણાને વાળીને સમધન બનાવવાની શરૂઆત કરશો.

તમારો સમધન કેટલો મોટો છે ?



- તમારા સમધનની બાજુની લંબાઈ કેટલી છે? _____
- તેના પર 1 સેમીના કેટલાં સમધન ગોઠવી શકાય?
 - લંબાઈ ? _____
 - પહોળાઈ ? _____
 - ઊંચાઈ ? _____
- થિભુના પ્રશ્નોના ઉત્તર આપો :



કાગળના સમધન જેટલો મોટો મંચ બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમધનની જરૂર પડે?

ટેબલ પર પ્રથમ સ્તર બનાવવા માટે મારે 1 સેમીના કેટલા સમધનનો ઉપયોગ કરવો પડશે?.....



કાગળનો પૂરો સમધન બનાવવા માટે મારે કેટલા સ્તરની જરૂર પડશે?.....

- આથી 1 સેમીના કુલ સમધન =
- કાગળના સમધનનું કદ એ 1 સેમીના..... સમધન જેટલું છે.


જો આપણે બાજુનું માપ 19.5 સેમી હોય તેવા ચોરસથી શરૂઆત કરીએ તો આપણને બાજુનું માપ 7 સેમી હોય તેવો સમધન મળશે.






2. આનને એક મોટો સમધન બનાવ્યો કે જેની બાજુની લંબાઈ તમારા કાગળના સમધનની બાજુની લંબાઈ કરતાં બમણી હતી.

તમારા કાગળના કેટલા સમધન તેમાં ગોઠવાઈ શકશે? તમારા વર્ગમાં બનાવેલા તમામ સમધન એકઠા કરીને મોટો સમધન બનાવવાની કોણીશા કરો.



સમધનને ગોઠવો.

ગણેશ અને ડિગા 1 સેમીના 4000 ઘનને એક પેટીમાં ગોઠવવા ઈચ્�ે છે. આ બધા ઘનને એક શાળામાં મોકલવાના છે. તેઓને ગોઠવવા માટે ત્રણ જુદાં જુદાં ખોખા ઉપલબ્ધ છે.



શું આપણે 4000 ઘનને આ ત્રણ ખોખામાં ગોઠવી શકીશું?
મને લાગે છે કે આપણે એક વધુ ખોખાની જરૂર પડશે.



હું વિચારું છું કે આ બધા 4000 ઘનને ગોઠવવા માટે ત્રણ ખોખાઓ પૂરતાં છે.

- તમારું અનુમાન શું છે? કોણ સાચું છે?
- સમધનને ખોખામાં ગોઠવતાં પહેલાં ગણેશ અને ડિગા તેમનાં અનુમાન કેવી રીતે ચકાસે છે? તમારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરો.



ખોખું A જુઓ. પ્રથમ સ્તરમાં આપણે $20 \times 10 = 200$ ઘન ગોઠવી શકીએ અને આવા 6 સ્તર ગોઠવી શકીએ આથી ખોખા A માં $200 \times 6 = 1200$ ઘન ગોઠવી શકાય.





ગણેશની રીતનો ઉપયોગ કરો અને લખો

- * ખોખા Bમાં 1 સેમીના સમધન ગોઠવી શકાય.
- * ખોખા Cમાં 1 સેમીના સમધન ગોઠવી શકાય.
- * આથી બધાં મળીને ત્રાણેય ખોખામાં કુલ 1 સેમીના સમધન ગોઠવી શકાય.

કઈ પાઈપ વધારે ભરશો?

કેટલાક જૂના પોસ્ટકાર્ડ એકડા કરો. તમે 14 સેમી x 9 સેમીના માપનો જોડો કાગળ પણ ઉપયોગમાં લઈ શકો. પાઈપ - 1 બનાવવા માટે પોસ્ટકાર્ડને તેની પહોળાઈ પરથી વાળો. બંને છેડાને સેલોટેપથી જોડો.




બીજો પોસ્ટકાર્ડ લઈને તેને લંબાઈ પરથી વાળો. તેને પાઈપ - 2 કહો. બંને છેડાને ટેપ વડે જોડો.

* અનુમાન કરો કે કઈ પાઈપની અંદર વધારે રેતી ભરી શકાય. તેને પ્લેટ પર ગોઠવો અને તેમાં રેતી ભરીને તમારું અનુમાન ચકાસો. શું તમારું અનુમાન સાચું હતું? ચર્ચા કરો.

હવે અહીં બતાવેલ અન્ય પાઈપો માટે પણ આ જ કિયા કરો.

ત્રિકોણાકાર પાઈપ-3 બનાવવા માટે, પોસ્ટકાર્ડ પર બે રેખાઓ દોરો. પોસ્ટકાર્ડને રેખા પરથી વાળો. બંને છેડાને ટેપ વડે જોડો. હવે ચોરસ પાઈપ-4 બનાવો.

કઈ પાઈપમાં વધુ રેતી ભરી શકાય તે શોધો. આવી કઈ પાઈપનું કદ (ઘનફળ) સૌથી વધુ છે?



વિદ્યાર્થીઓને પાન 155 પરની દોરીની પ્રવૃત્તિ યાદ કરાવો જ્યાં તેઓએ જોયું હતું કે એક જ માપની પરિમિતિથી બનાવેલા વિવિધ આકારોમાં વર્તુળનું ક્ષેત્રફળ સૌથી વધુ હતું. અહીં તેઓ કાગળનું ક્ષેત્રફળ ચોક્કસ રાખીને સૌથી વધુ કદ (ઘનફળ) ધરાવતો આકાર શોધવાનો છે.





ગંગોત્રીની યાત્રા

ધૌરણ 12ના વિદ્યાર્થીઓ ગંગોત્રીની યાત્રા પર જાય છે. તેઓએ છ દિવસ માટેનો સામાન બાંધવાનો છે અને તે હળવું રખવાનું છે. તેઓએ એવી વસ્તુઓ લેવાની છે કે જે વધારે જગ્યા ન રોકતી હોય. આથી તેઓ એવી વસ્તુઓ શોધશે કે જે વજનમાં હળવી હોય અને જગ્યા ઓછી રોકતી હોય. અંતમાં તો જયારે તેઓ પર્વત પર ચઢી રહ્યા હોય ત્યારે તેમનો સામાન તેઓએ જ ઉંચકવાનો છે.

વજન હળવું કરવા માટે તેઓએ ટામેટાં તથા કુંગળીને પણ સૂકવી નાંખ્યા. જયારે તેમની અંદરનું પાણી સૂકાઈ ગયું ત્યારે 1 કિલોગ્રામ કુંગળી અને ટમેટાં 100 ગ્રામમાં પરિવર્તિત થઈ ગયા.

- 1 દિવસના ભોજન માટે દરેક વ્યક્તિને જરૂરી ખોરાકની યાદી

- ચોખા : 100 ગ્રામ
- લોટ : 100 ગ્રામ
- કઠોળ (દાળ) : ચોખા અને લોટના વજનના $\frac{1}{3}$ ગણા
- તેલ : 50 ગ્રામ
- ખાંડ : 50 ગ્રામ
- દૂધનો પાઉડર : 40 ગ્રામ (ચાકંજી અને ગરમ પીણાં માટે)
- ચા : લગભગ 10 ગ્રામ
- દલિયા : 40 ગ્રામ નાસ્તા માટે
- મીઠું : 5 ગ્રામ
- સૂકી કુંગળી : 10 ગ્રામ
- સૂકાં ટમેટાં : 10 ગ્રામ





- (a) 6 દિવસ માટે, દરેક વિદ્યાર્થીને જરૂર પડશે
- ચોખા અને લોટ - _____ ગ્રામ • કઠોળ (દાળ) - _____ ગ્રામ
 - સૂકી હુંગળી - _____ ગ્રામ.
- (b) 6 દિવસ સુધી 10 લોકો માટે કેટલાં તાજાં ટમેટોને સૂક્પવવા પડશે?
- (c) દરેક વિદ્યાર્થીની બેગમાં (6 દિવસ માટે) ખોરાકનું કુલ વજન કેટલું હશે?



એક ગ્રામ વધુ વજન
પણ યાત્રાને કઠિન
બનાવી શકે છે!


અનુમાન કરો કે અમારા માંથી
કેટલી એક સાથે તોલવામાં આવે
તો 1 ગ્રામ બરાબર થાય!
આશરે 100?




હું કેટલો વજનદાર છું?

વેદિકાની પુત્રીએ હાથીનું વજન કેવી રીતે શોધ્યું હતું તે તમને યાદ છે? (ગણિત-ગમ્મત,
ધોરણ-4 પાન નં. 143 જુઓ)

તમે પૃથ્વી પરના સૌથી વજનદાર પ્રાણીના વજન
વિશે અનુમાન કરી શકો છો? ના, હું તે નથી મારું
વજન તો માત્ર 5000 કિગ્રા છે!



તે જ્યું વહેલ છે. તેનું વજન મારા કરતાં
લગભગ 35 ગણ્યું વધારે છે. આથી તેનું વજન
કેટલાં હજાર કિગ્રા હશે?





- * અંદાજ લગાવો કે તમારા વજન જેટલું વજન ધરાવતાં કેટલાં બાળકોનું વજન 5000 કિલોગ્રામ વજન ધરાવતા એક હાથીના વજન જેટલું થાય.
 - * જન્મ સમયે મદનિયાનું વજન લગભગ 90 કિગ્રા હોય છે. તમારા જન્મ સમયે તમારું વજન કેટલું હતું? શોધી કાઢો. જન્મ સમયે મદનિયાનું વજન તમારા વજન કરતાં કેટલાં ગણું હોય?
 - * જો એક જુવાન હાથી એક દિવસમાં 136 કિગ્રા ખોરાક ખાય તો તે એક મહિનામાં લગભગ કિગ્રા ખોરાક ખાઈ જશે?
- અનુમાન કરો કે તે એક વર્ષમાં કેટલો ખોરાક ખાશે!

શાહીદ બેન્ક બચાવી

શાહીદ બેન્કમાં કામ કરે છે. તે કેશ કાઉન્ટર પર બેસે છે. જ્યારે તેની પાસે ઘણા બધા સિક્કા ભેગા થાય છે ત્યારે તે તેને ગણતો નથી. તે માત્ર તેનું વજન કરે છે.



તોલવું વધુ આસાન છે! પાંચ રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે. તમે મને થેલીનું વજન કહો અને હું તમને તેની અંદર રહેલા સિક્કાની સંખ્યા બતાવું.



શું તમે આ સિક્કાઓને હાથમાં લઈને કહી શકો કે ક્યો સિક્કો સૌથી વજનદાર છે?

મારા 5 રૂપિયાના સિક્કાવાળા થેલાનું વજન 9 કિલો છે, તો તેમાં કેટલા સિક્કા હશે?



1 કિગ્રા = 1000 ગ્રામ. આથી
9 કિગ્રા = 9000 ગ્રામ. જો એક સિક્કાનું વજન 9 ગ્રામ હોય તો
થેલાનું વજન 9000 ગ્રામ
હોવાથી $9000 \div 9 =$ _____
સિક્કા તેમાં છે. છેને સરળ!





* 5 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કરવામાં આવે તો તેમાં કેટલા સિક્કાઓ હોશે? જો તેનું વજન

- (a) 18 કિગ્રા હોય તો? _____ (b) 54 કિગ્રા હોય તો? _____
- (c) 4500 ગ્રામ હોય તો? _____
- (d) 2 કિલો અને 250 ગ્રામ હોય તો? _____
- (e) 1 કિલો અને 125 ગ્રામ હોય તો? _____

2250 ગ્રામને 2
કિલો અને 250 ગ્રામ
લખી શકાય.
સમજાવો શા માટે ?



* બે રૂપિયાના સિક્કાનું વજન 6 ગ્રામ છે. તો બે રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય? જો તેમાં _____

- (a) 2200 સિક્કા હોય તો? _____ કિલો _____ ગ્રામ
- (b) 3000 સિક્કા હોય તો? _____ કિલો _____ ગ્રામ

* જો એક રૂપિયાના 100 સિક્કાનું વજન 485 ગ્રામ હોય તો 10000 સિક્કાનું વજન કેટલું થાય?

_____ કિલો _____ ગ્રામ

તમારી આંખો બંધ કરીને તમે કહી શકશો કે શું વજનદાર છે? 100 રૂપિયાની નોટ કે 50 રૂપિયાની નોટ? આ કહેવું મુશ્કેલ છે, પરંતુ શાહીદ કે જે જોઈ શકતો નથી તેનામાં વસ્તુને અડકીને ઓળખવાની ક્ષમતા અન્ય લોકો કરતાં ઘણી સારી છે.

એકવાર શાહીદ નોંધ્યું કે બેન્કમાં આવેલું નોટોનું બંડલ કંઈક અલગ તથા વજનદાર છે. તેણે મેનેજરને તે તપાસવા માટે કહું. અન્ય લોકોએ પણ તે જોયું પરંતુ તેમાં તેમને કોઈ તકલીફ જણાઈ નહિ. તેણે તે તપાસવા આગ્રહ કર્યો. આથી તેનું વજન કરવા માટે મશીન મંગાવવામાં આવ્યું. તે પછી ખબર પડી કે નોટો અસલી નહિ પરંતુ નકલી હતી. બધાએ કહું વાહ શાહીદ તેં ખરેખર બેન્કને બચાવી લીધી.

શોધી કાઢો અને ચર્ચા કરો




- * જે લોકો જોઈ નથી શકતા તે વિવિધ નોટો તથા સિક્કાને કેવી રીતે ઓળખે છે? (સૂચન : 20, 50, 100, 500 રૂપિયાની નોટો પરના આકાર ▲■●■ વગેરેને અડીને શોધી કાઢો.)
- * 100 રૂપિયાની નોટ અસલી છે કે નકલી તે નક્કી કરવા માટે આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ?



નોટ અસલી છે કે નકલી તે ચકાસતી વખતે તેની બિન્ન બિન્ન બાબતોનું નિરીક્ષણ કરવું જોઈએ. નકલી નોટનાં માપ, કાગળની ગુણવત્તા, છાપકામ તથા આંકડા લખવાની રીત વગેરે અલગ રીતે હોય છે. (ગાંધીજીના ઝોટા સાથેનો સફેદ ભાગ), વોટરમાર્ક, શબ્દો ભારત અને RBI ચણકતા સુરક્ષા તાર પર લખેલા હોય છે વગેરે એટલા માટે હોય છે કે જેથી નકલી નોટ છાપી ન શકાય.



કાગળને કાપો



મીઠાઈનું ખોખું

ઘાટી રેખાઓ પરથી કાપો. તેને જડા કાગળ પર ચોટાડો. પાન 126 પર બતાવ્યા મુજબનું મીઠાઈનું ખોખું બનાવવા માટે તેને તૂટક રેખાઓ પરથી વાળો.

